

સાંવત્ಸરિક કષમાપના

જીવન જીવવા માટે અનેક લોકોના સ્થળ કે સૂક્ષ્મ સહકારની અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ એકસરખી હોતી નથી, એથી વ્યક્તિ-વ્યક્તિના પુરુષાર્થમાં ફરક રહે છે; પરંતુ જેમની પાસે કર્મયોગે વધુ શક્તિ હોય છે તેવી વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર જેવાં લક્ષણો આવી જાય છે. એથી વ્યવહારની સમતુલ્ય ખોરવાય છે. ટ્રેન, પિકાર, ઈઞ્ચા, નિદા, અદિતચિંતા વગેરે ભાવોમાંથી ઘર્ષણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે છે. અનુદારતા, અસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિઓ જોર પકડતાં પરસ્પરનો વ્યવહાર દૂષિત થાય છે. ઉપેક્ષા-અશાબનાવથી માંડીને લડાઈ-ઝડા સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-રસ, સુખમય, શાંતિમય બનાવવા માટે પ્રેમ, સહકાર, ઉદારતા, સહિષ્ણુતા વગેરેની સાથે ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે છે.

પોતની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પોતાના પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉધાર દિલથી ક્ષમા આપવી એમ ઉલ્લય પ્રકારે, ક્ષમાપના કરવાની હોય છે.

આપણું અજ્ઞાન, આપણી ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણાને ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂલો તદ્દન નખુંવી હોય છે; તો કેટલીક ભયંકર, જીવસંધારની કોટિ સુધીની હોય છે. જે માણસ જાગ્રત છે તે પોતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્કષણ ક્ષમા માગી લે છે. ક્યારેક ભૂલની ખબર મોડી પડતાં ક્ષમા માગવામાં સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ છરાદાપૂર્વકની હોય, તો ક્યારેક અજ્ઞાનાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારો આપણા ચિત્તમાં ઊઠીને શરીરી જાય છે. એના માત્ર આપણો

पोते जे साक्षी छोईअे छीअे. क्यारेक अशुभ विचारा बीजा आगल शब्दमः व्यक्त थઈ जाय छे, परंतु ए प्रमाणे स्थूल आचरण करतां आपां अटकीअ छीअे; तो क्यारेक विचारना आवेग के भावना आवेश प्रमाणे स्थूल होष पडा करी लेसीअे छीअे.

मनुष्यनुं चित्तान्त ऐटलुं बधुं संकुल छे के ओमां उठाता प्रत्येक अशुभ विचारनी गणतरीपूर्वकनी नौंद राखवानुं सरण नथी. माटे जे क्षमापनानो आचार व्यापक कारणे अने धोरणे स्वीकारवानी जुरुर रहे छे. ऐटला माटे जे भन, वयन अने कायाची तथा करतां, करावतां अने अनुभोदतां एम त्रिविधेत्रिविध प्रकारे (नव डोटिअ) अने ते पडा जाणातां-अजाणातां थयेलो दौष्टो माटे क्षमा भागवानी होय छे. ए भागती वभते गरीब-तवंगर, सुशिक्षित-अशिक्षित, नाना-मोटा, गुरु-शिष्य, शेठ-नोकर इत्यादिना लेदनो विचार न करतां पोते जे सामेथी क्षमा भागी लेवी जोईअे.

आपणे क्या भाषासनी क्षमा भागीशुं ? मात्र भाषास शा माटे ? समस्त छवराशिनी हाथ जोडी, नतमस्तके, हृदयमां धर्मभाव धारणा करीने क्षमा भागीअे, के जेथी अजाणातां कोई पडा छवनी क्षमा भागवानुं रही न जाय. शास्त्रकार कहे छे :

सब्बस्स जीवरासिस्स भावओ धर्मनिहिअ निअ चित्तो।

सब्बं खमावईता खमासि सब्बस्स अहयंपि॥

शास्त्रकारोअे काणनी दृष्टिअ दैनिक, पार्श्विक, चातुर्भासिक अने सांवत्सरिक अवा चार मुख्य प्रकार क्षमापना माटे बताया छे. पहेला त्रिष्ण प्रकार चूडी जवाय तो छेवटे सांवत्सरिक क्षमापना तो दरेक भाषासे अवश्य करी जे लेवी जोईअे, के जेथी ए ऋषाभांथी भुक्त थઈ जवाय. शास्त्रकारो कहे छे के जे भाषास सांवत्सरिक क्षमापना चूडी जाय छे अना क्षायो अनंतानुबंधी बनी जाय छे. वली अने जो सम्फङ्गत्वं प्राप्त थयुं होय तो ते चाल्यु जाय छे. सम्फङ्गत्वनी प्राप्ति माटे अने क्षायोनी भंदता माटे क्षमाना तत्पने अथी छवनमां उतारवानी आवश्यकता छे.

भूल तो बधांनी थाय, पडा क्षमा बधां भागतां नथी. परंतु जे क्षमा भागे छे अथवा बीजाने क्षमा आपे छे तेना छवनमां दैवी अंशो प्रगट थाय छे. To err is human, but to forgive is divine. क्षमा भागवी अने आपवी ए अप्रभत्त चित्तानी निशानी छे. क्षमा साथे जो पश्चात्ताप, हृदय-परिवर्तन,

કરી એવી ભૂલ ન થાય તે માટેનો સંકલ્પ હત્યાર્થ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમા ઉંચા પ્રકારની બને છે.

માત્ર ઉપયાર તરીકે શબ્દોચ્ચાર કરીને 'મિચા મિ હુક્કડમ' કહેવું એ દ્રવ્ય-ક્ષમા છે. વ્યવહારમાં એની પણ આપશ્યકતા છે; પરંતુ માણસે દ્રવ્ય-ક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું છે.

ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છે : ઉપકાર-ક્ષમા, અપકાર-ક્ષમા, વિપાક-ક્ષમા, વચન-ક્ષમા (આજ્ઞા-ક્ષમા) અને ધર્મ-ક્ષમા. જેણો આપણા ઉપર ધણો મોટો ઉપકાર કર્યો હોય તેવી વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ ઉપકાર-ક્ષમા છે. જેના તરફથી આપણા ઉપર અપકાર થવાનો ડર રહે છે તેની આપણે તરત માફી માગી લઈએ છીએ. એ અપકાર-ક્ષમા છે. મોટાં અશુભ કર્માનો દુઃખદાયક વિપાક જ્યારે થાય છે ત્યારે તે વખતે આપણે આપણાં ભૂતકાલીન અશુભ કર્માને માટે તથા ભવિષ્યમાં એવાં મોટાં દુઃખો ન આવી પડે એવા ભયથી ક્ષમા માગી લઈએ છીએ. એ વિપાક-ક્ષમા છે. તીર્થકર ભગવાનનાં આજ્ઞા-વચન સાંભળીને એમના ઉપદેશ અનુસાર આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે વચન-ક્ષમા. સમ્યકૃત હોય તો જ આવી ક્ષમા આવે. ધર્મની સાચી સમજહામાંથી આત્માના સ્વાભાવિક ધર્મ તરીકે એટલે કે આત્માના સ્વભાવ તરીકે ક્ષમાનો જે ભાવ પ્રગટ થાય છે તે ધર્મ-ક્ષમા છે. ભયંકર નિમિત્તો મળતાં પણ ગજસુકુમાલ, મેતારજ મુનિ વગેરેની જેમ ક્ષમાનો ભાવ રહે તે ધર્મ-ક્ષમા. પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની-મિથ્યાત્ત્વી માણસોને પણ હોઈ શકે.

આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમા શ્રેષ્ઠ છે. તે અનાયાસ હોય છે. પ્રતિક્ષણ તમામ જીવો પ્રત્યે ક્ષમાનો ભાવ સહજ રીતે જ વહ્યા કરે તે સહજ ક્ષમા છે. આપણી ધર્મક્ષમા સહજ ક્ષમા બની રહેવી જોઈએ.

ભૂલનો બચાવ કરી બીજાની સાથે લડવા માટે તત્પર એવા ઘણા લોડો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસો પણ હોય છે કે જેઓ ભૂલનો સ્વીકાર કરી, તે માટે તરત ક્ષમા માગી લે છે. ક્ષમા માગવી એ બહુ અધરી વાત નથી. પરંતુ બીજા કોઈએ આપણા પ્રત્યે ભૂલ કરી હોય તો તેનો બદલો ન લેતાં તેને સાચા દિવની ક્ષમા આપવી એ દુઃખર કાર્ય છે. ઘણા માણસો બીજા માણસને એની નાનકડી ભૂલ માટે બરાબર પાઠ ભણાવવાના આશયથી ઘણું

મોટું વેર વાળે છે. પરંતુ સહિષ્ણુ અને ઉદાર એવા મહામના માણસો એવા પ્રસંગે પણ એને સાચી ક્ષમા આપી, અનું હિત છથું છે. બીજા જીવો પ્રત્યે હદ્યમાં સાચો કરુણાભાવ હોય તો જ આમ બની શકે.

ક્ષમા એ કરુણાની બહેન છે, અને અહિંસાની દીકરી છે. ક્ષમા ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની અપેક્ષા રહે છે. એટલા માટે જ ક્ષમા વીરસ્ય ભૂષણમ् ક્ષમા તેજસ્વિનામ् ગુણः, ક્ષમા રૂપં તપસ્વિનામ् વગેરે ઉક્તિઓ પ્રચાચિત છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પંચ પરમેષ્ઠીને – સાધુથી અર્થિંતો(તીર્થકરો)ને આપણે ‘ક્ષમાશ્રમણ’ (ખમાસમણ) કહીને વંદન કરીએ છીએ.

કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે. કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે ઓળખાવે છે.

*“Mutual forgiveness of each vice,
Such are the gates of paradise.”*

જેન ધર્મમાં તો ક્ષમાને મોક્ષના ભવ્ય દરવાજા તરીકે ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હદ્યપૂર્વકના સાચા ભાવથી જીવને મોટી કર્મનિર્જરા થાય છે. ક્ષમા કર્મકષય દ્વારા, મુક્તિ સુધી જીવને પહોંચાડે છે.

ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના પરિપૂર્ણ થતી નથી. જેણો આરાધનાની ઇમારત ચણાવી હોય તેણો ક્ષમાનો પાયો નાખવો પડશે. ક્ષમા માળીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતો નથી તે સાચો આરાધક બની શકતો નથી.

ભદ્રબાહુસ્વામીએ એટલા માટે જ કહું છે :

જો ઉવસમઝ તસ્સ અત્થિ આરાહણા ।

જો ન ઉવસમઝ તસ્સ નત્થિ આરાહણા ।

તમ્હા અપ્યણ ચેવ ઉવસમિયવ્યં ।

ક્ષમાની સાથે મૈત્રી જોડાયેલી છે. મૈત્રી હોય ત્યાં વેરભાવ ન હોય. ક્ષમા સમય વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવામાં ઘણો મોટો ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોડાનું નિર્ણતર ભાવરટણ હોય છે :

ખામેણિ સંવ જીવે, સંવે જીવા ખમંતુ મે ।

મિત્તી મે સંવ ભૂણુ, વેરં મજ્જ ન કેળિ ॥

[હું બધા જીવોને ખમાવું છું. બધા જીવો મને ક્ષમા આપે. સર્વ જીઓ સાથે મારે મૈત્રી છે. કોઈ સાથે મારે વૈરભાવ નથી.]

જૈનોનું પર્યુધણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિભિત્તે પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા ઘણી હશે. તો પણ જીવનને સુસંવાદી બનાવવામાં આ પર્વનો ફાળો ઓછો નથી. વિશ્વશાંતિની દિશામાં એ એક મોટું પગલું છે.

દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મોટું પર્વ મનાવવાનું ફરમાવ્યું હોય તો તે માત્ર જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન છે. માનવજીત સાટે એ મોટું વરદાન છે.

